

LL.B. Semester - 3 (CBCS) Examination
Nov/Dec-2023 (Syllabus Year - 2016)
BANKING LAW(ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ બેંકની વ્યાખ્યા આપો. બેંકનું મહત્વ અને ઐતિહાસિક વિકાસ જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૧ ભારતમાં બેંકિંગ કંપનીઓને લગતા કાયદા વિષે ચર્ચા કરો.
- પ્રશ્ન-૨ બેન્કર અને ગ્રાહક વચ્ચે સામાન્ય અને કાનૂની સંબંધની વિસ્તૃત ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૨ બેંકિંગ સેવાઓ સંબંધિત ફરીયાદોમાં બેંકિંગ લોકપાલનની ભૂમિકાની ચર્ચા કરો.
- પ્રશ્ન-૩ ભારતમાં બેંકિંગ પ્રણાલીના તાજેતરના પ્રવાહો વિષે ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૩ તફાવત સમજાવો. ધારણ કરનાર અને યથાનુક્રમે ધારણ કરનાર
- પ્રશ્ન-૪ તમારા મત પ્રમાણે ચેક પર ક્રોસિંગ કરવું એટલે શું? ચેક પર ક્રોસિંગ ના પ્રકાર સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૪ કરજ વસુલાત ધારો ૧૯૯૩ અંતર્ગત અપીલ ન્યાયપંચને અપીલની કાર્યવાહી અને સત્તાઓ સમજાવો.
- પ્રશ્ન-૫ ટુંકનોંધ લાખો (કોઈપણ બે) (૧૪)
- 1) ક્રેડિટ કાર્ડ
 - 2) બેંકના વિવિધ પ્રકારના ગ્રાહકો
 - 3) SEBI રેગ્યુલેશન ધારો ૧૯૯૨
 - 4) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

ENGLISH VERSION

- Que-1 Define Bank. State the historical development and importance of Bank. (14)
 OR
- Que-1 Discuss the law relating to banking companies in India.
- Que-2 Elaborate general and legal relationship between banker and customer. (14)
 OR
- Que-2 Discuss the role of Banking Ombudsman in complaint relating to Banking services.
- Que-3 Discuss in detail the Recent trends of Banking system in India. (14)
 OR
- Que-3 Distinguish between Holder and Holder in due course.
- Que-4 What do you mean by crossing of Cheque? Explain the types of crossing of Cheque. (14)
 OR
- Que-4 Explain the procedure and powers of appellate Tribunal under the Debt recovery Tribunal Act. 1993.
- Que-5 Write Short note: (Any Two) (14)
- 1) Credit Card
 - 2) Types of customers of a Bank
 - 3) SEBI Regulations, 1992.
 - 4) RBI (Reserve Bank of India)
